



IDT (Integrated Device Technology)

Technology)



8N4SV76KC-0049CDI

ભાગ નંબર:	8N4SV76KC-0049CDI
ઉત્પાદક / બ્રાન્ડ:	IDT (Integrated Device Technology)
ઉત્પાદન વર્ણન	IC OSC VCXO 150MHZ 6-CLCC
માહિતી પત્ર:	1.8N4SV76KC-0049CDI.pdf 2.8N4SV76KC-0049CDI.pdf
RoH સ્થિતિ	હીડ ફ્રી / આરઓએચએસ સુસંગત
શિપ	હોંગ કોંગ
શિપમેન્ટ વે	DHL/Fedex/TNT/UPS/EMS

[અવતરણ માટે વિનંતી](#)

છબી સ્ક્રીનશોટ હેઠળ છે. ઉત્પાદન વિગતો માટે વિશિષ્ટતાઓ જુઓ.













8N4SV76KC-0049CDI ની વિશિષ્ટતાઓ

ભાગ નંબર	8N4SV76KC-0049CDI
ઉત્પાદક	IDT (Integrated Device Technology)
વર્ણન	IC OSC VCXO 150MHZ 6-CLCC
હીડ ફ્રી સ્ટેટસ / રોએચએસ સ્ટેટસ	હીડ ફ્રી / આરઓએચએસ સુસંગત
ડેટા શીટ	1.8N4SV76KC-0049CDI.pdf 2.8N4SV76KC-0049CDI.pdf
વોલ્ટેજ - સપ્લાય	3.135 V ~ 3.465 V
વર્ણન	VCXO
સપ્લાયર ઉપકરણ પેકેજ	6-CLCC (7x5)
સિરીઝ	FemtoClock® NG
પેકેજિંગ	Tray
પેકેજ / કેસ	6-CLCC
બ્રાન્ડ નામો	IDT8N4SV76KC-0049CDI IDT8N4SV76KC-0049CDI-ND
ઓપરેટિંગ તાપમાન	-40°C ~ 85°C
માઉન્ટિંગ પ્રકાર	Surface Mount
ભેજ સંવેદનશીલતા સ્તર (એમએસએલ)	1 (Unlimited)
હીડ ફ્રી સ્ટેટસ / આરઓએચએસ સ્થિતિ	Lead free / RoHS Compliant
આવર્તન	150MHz
વિગતવાર વર્ણન	VCXO IC 150MHz 6-CLCC (7x5)
વર્તમાન - પુરવઠો	140mA
ગણતરી	-
આધાર ભાગ નંબર	IDT8N4SV76KC

સંબંધિત સ્પસ

IDT (Integrated Device Technology) 8N4SV76KC-0049CDI	8N4SV76KC-0049CDI ડિસ્ટ્રિબ્યુટર	8N4SV76KC-0049CDI સપ્લાયર
8N4SV76KC-0049CDI ભાવ	8N4SV76KC-0049CDI ચિત્રો	8N4SV76KC-0049CDI છબી
8N4SV76KC-0049CDI પીડીએફ ડેટાશીટ	8N4SV76KC-0049CDI ડાઉનલોડ ડેટાશીટ	8N4SV76KC-0049CDI ડેટાશીટ
8N4SV76KC-0049CDI સ્પેક	8N4SV76KC-0049CDI અરીદો	IDT (Integrated Device Technology) 8N4SV76KC-0049CDI અરીદો
IDT (Integrated Device Technology) 8N4SV76KC-0049CDI	IDT (Integrated Device Technology) સપ્લાયર	IDT (Integrated Device Technology) વિતરક
IDT (Integrated Device Technology) 8N4SV76KC-0049CDI	IDT 8N4SV76KC-0049CDI	IDT (Integrated Device Technology) 8N4SV76KC-0049CDI
IDT, Integrated Device Technology Inc 8N4SV76KC-0049CDI	Integrated Device Technology (IDT) 8N4SV76KC-0049CDI	

સંબંધિત વસ્તુઓ

 <p>8N4SV76KC-0051CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 672.1562MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0048CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 159.375MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76KC-0050CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 622.08MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0046CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 200MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76KC-0050CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 622.08MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0051CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 672.1562MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76KC-0049CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 150MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0047CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 24.576MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76KC-0052CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 425MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0048CDI8 ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 159.375MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>
 <p>8N4SV76KC-0046CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 200MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>	 <p>8N4SV76KC-0047CDI ઉત્પાદક: IDT (Integrated Device Technology) વર્ણન: IC OSC VCXO 24.576MHZ 6-CLCC ઉપલબ્ધ છે: Out stock</p> <p style="text-align: center;">RFQ</p>